

ગુજરાતમિત્ર ભવિષ્ય દર્શન

કુંભ (ગ.સ.શ.)



માનસિક સ્થિતિ :

માય ડિઅર,

દરેક માણસની એ મર્યાદા હોય છે કે એ પોતે કેવો છે એની એને પોતાને જ ખબર હોતી નથી! બીજા માણસો કેવા છે એની એને બધી જ ખબર હોય છે. દરેક વ્યક્તિ બીજાના સ્વભાવનો અભ્યાસ કરતો રહે છે. બીજાના સ્વભાવનું પૃથ્થકરણ અને અર્થઘટન નિયમિત કરતા રહે છે. મારો બાપ કેવો છે? મારો ભાઈ કેવો છે? મારા મિત્રો કેવા છે, મારા પાડોશી કેવા છે અને મારા સગા સંબંધી કેવા છે? આ બધાનો સ્વભાવ કેવો છે તેની ઝીણામાં ઝીણી હકીકતનું એના મગજમાં ગોડાઉન ભરેલું હોય છે. સામા માણસના સ્વભાવના પ્લસ પોઈન્ટ અને માઈનસ પોઈન્ટ આપણે એટલી સારી રીતે જાણતા હોઈએ છીએ કે એની પર્સનાલિટીની ઝેરોક્ષ કોપી આપણે રજૂ કરી શકીએ છીએ.

પરંતુ માણસ પોતે કેવો છે? એની એને જ ખબર હોતી નથી! પોતાના સ્વભાવમાં રહેલા ગુણદોષ વિશે એ ક્યારેય વિચારતો નથી. એનું કારણ છે કે દરેક માણસ પોતાના હૃદયના ઊંડાણથી એમ જ માનતો હોય છે કે હું તો સારો માણસ જ છું. આપણે એટલે કોણ? આપણામાં કોઈ માઈનસ પોઈન્ટ નથી! હવે એક વિચિત્રતા જુઓ: કોઈ માણસ એના સ્વભાવના પ્લસ પોઈન્ટ બતાવે, એની પ્રશંસા કરે અને એની વાહ વાહ કરે ત્યારે એના સ્વભાવ માટે એને ગૌરવ થાય છે, કે હું કેવો સારો છું! પરંતુ જો કોઈ એના માઈનસ પોઈન્ટ બતાવે, એના સ્વભાવમાં રહેલા દુર્ગુણ બતાવે તો એ એની સાથે સહમત થતો નથી. એ કહેશે કે આ તો તમારો ભ્રમ છે. મારો સ્વભાવ આવો છે જ નહીં. જેમાં તમારા સ્વભાવની પ્રશંસા થતી હોય તો વાત સ્વીકારી લેવાની અને કોઈ તમારો દુર્ગુણ બતાવે તો એ સ્વીકારવાની નહીં. કેમ ભાઈ! જેમ તમે બીજાનો સ્વભાવ જાણો છો તેમ લોકો પણ તમારો સ્વભાવ

આઈ મીન, તમે કેવા છો તે જાણે છે.

હવે અહીંથી તમારી વારતા શરૂ થાય છે

આ વરસના આપના ગ્રહમાન પ્રમાણે તમારે તમારી જાતનું તટસ્થપણે નિરિક્ષણ કરવાની જરૂર છે. તમને ગમતા માણસો, તમને મદદ કરતા માણસો, તમારે ફરજિયાત જેમને નિભાવવા પડે એ બધા માણસો તમારા માટે સારા છે અને તમને નહીં ગમતા કે તમારો વિરોધ કરતા માણસો સારા નથી. આ બંને બાબતમાં તમારી આંધળી લાગણીશીલતા અને ખોટા પૂર્વગ્રહ કામ કરતા હોય છે. આવનારો સમય તમારે માટે સારો જ નહીં પણ ઘણો સારો છે. પરંતુ તમારા સ્વભાવના કેટલાક માઈનસ પોઈન્ટસ અને વિચિત્રતાને લીધે આ સારા સમયમાં મળવાના લાભ તમે લઈ શકશો નહીં. સારા સમયમાં મળનારી તક તમે ઝડપી શકશો નહીં અને એના ફાયદા મેળવી શકશો નહીં. આનાથી તમને મોટું નુકસાન એ છે કે તમે જાતે જ તમારા સ્વભાવને લીધે તમારી પ્રગતિમાં રૂકાવટ ઊભી કરી રહ્યા છો.

માટે હે, મહાત્મા ! બીજા કેવા છે એની માથાકૂટ છોડી દો, અને તમે કેવા છો? એનો અભ્યાસ કરીને જો સુધરવાના પ્રયત્નો કરશો તો જિંદગીના આપના બધા સપના સાકાર કરી શકશો. આપની બધી ઈચ્છા પૂરી કરી શકશો. સફળતા મેળવી શકશો.

પછી શિષ્યએ પૂછ્યું : હે ગુરુજી અરિસાની સામે અરિસો મૂકવાથી આપણને શું ખબર પડે?

ગુરુજીએ કહ્યું : - હે વત્સ, અરિસાની સામે અરિસો મૂકવાથી એ હકીકતની ખબર પડે છે કે 'બંને અંદરથી ખાલી છે.'

આર્થિક નાણાંકિય:

નાણાંકિય દૃષ્ટિએ નવા વરસનો સમય આપને માટે સંતોષકારક રહેશે. તેમ છતાં આપના ગ્રહમાન પ્રમાણે એવું લાગે છે તમે થોડા વધારે પ્રયત્નો કરો તો તમારી આવકમાં હજી પણ વધારો કરી શકો છો. અત્યારે આપને માટે સમય સારો ચાલે છે તો એનો લાભ તમારે લઈ લેવો જોઈએ. તમારી આવક વધારવા માટે તમને વરસ દરમ્યાન બે સારી તક પણ મળશે. કેટલાક સંજોગો પ્રતિકૂળ હોય તો તેમાંથી પણ તમે રસ્તો કાઢી શકો છો અને આવક વધારી શકો છો. વરસમાં સાધારણ ખોટા ખરચાઓ આવશે એની સગવડ કરવા માટે પણ આવક વધારવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં મોટું રોકાણ કરવાનું આયોજન પણ થઈ શકે.

દંધો-વેપાર - નોકરી:

આપના કામકાજ ધંધા માટે પણ આ વરસના ગ્રહમાન ઘણાં સારા છે. ચાલુ કામકાજ સંતોષકારક ચાલ્યા કરશે એટલું જ નહીં પણ ધંધામાં પ્રગતિ થાય. આપનું ટર્ન ઓવર વધે. નફો વધે અને વરસના અંતે ધંધામાં ઓછામાં ઓછો ચાલીસ થી

અરિસાની સામે અરિસો મૂકે હકીકતને હકીકત બતાવો

પયાસ ટકા વધારો થઈ શકે. આ ઉપરાંત ધંધામાં નવું રોકાણ કરવાનું કે ધંધામાં એક્સ્પાન્શન ડેવલપમેન્ટ કરવાનું પણ આયોજન થાય.

જો કે આપના કામકાજમાં ફેબ્રુઆરી માર્ચ અને જુન-જુલાઈમાં સાધારણ ટેન્શન થઈ શકે પરંતુ આ બધું ટેમ્પરરી છે. આમાંથી તમે સહેલાઈથી બહાર આવી શકશો. ભાગીદારીમાં કામકાજ થવાની પણ શક્યતા છે.

નોકરીવાળાને માટે પણ આ વરસનો સમય સારો છે. નોકરીમાં તમે કોઈ પણ બાબતે દુઃખી હોવ તો દુખના દિવસો હવે પૂરા થઈ રહ્યા છે. ઉપરી અધિકારી તેમજ સ્ટાફનો સહકાર સારો મળશે. ઈન્ફોર્મેન્ટ સાડું મળશે. પ્રમોશન ડયૂ હોય તો મળી જાય. નોકરીમાં વધારે પડતી દાદાગીરી કરશો તો સ્થળાંતર થઈ જશે!

જમીન - મકાન પ્રોપર્ટી:

પ્રોપર્ટીની બાબતમાં આ વરસમાં આપના ગ્રહમાન મધ્યમ છે. કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે તમારું પ્લાનીંગ હોય તો પણ કોઈને કોઈ કારણ થી તમારો નિર્ણય બદલાયા કરે અથવા આ કામમાં વિલંબ થયા કરશે. આ વરસના અંતમાં કે આવતા વરસની શરૂઆતમાં આ કામ માટે વધારે સારો સમય છે. ત્યારે તમારું કામ પાકકુ થઈ જાય. બાપ દાદાની મિલ્કતમાંથી પણ આ વરસમાં કંઈક મળવાની શક્યતા છે. પરંતુ તમે એનો ઉપયોગ નહીં કરી શકો.

લગ્ન અને દાંપ્ત્યજીવન:

જેમની ઉંમર લગ્ન કરવાને લાયક થઈ ગઈ હોય તેમને હજી થોડી રાહ જોવાની સલાહ છે. ઉતાવળ કરવામાં કંઈક ગરબડ થઈ જાય એવું લાગે છે. તેમ છતાં નવા વરસના અંત ભાગમાં તમારું કામ થઈ જાય.

દાંપ્ત્યજીવનમાં તમે સંજોગોને જો અનુકૂળ બનાવી શકો તો બધું બરાબર ચાલશે. બસ તમને પરસ્થિતિને અને લાગતા વળગતાને હેન્ડલ કરતા આવડવું જોઈએ. સામા માણસને તકલીફ નહીં થવી જોઈએ અને આપણું કામ પણ થવું જોઈએ એ રીતે જીવતા શીખવું પડશે. પહેલા તો મતભેદ નહીં થાય એના માટે તમારે એડવાન્સમાં વાતાવરણ ઊભું કરવું પડે. પછી તમારે કહેવાની જરૂર જ નહીં પડે કે મારે આમ કરવું છે! સામેથી તમને સર્પોઈ મળશે કે તમે જે કરવા માંગો છો તે બરાબર છે. તમારું તો કામ જ થઈ ગયું ને! ફરી એકવાર યાદ રાખો. તમારે એડવાન્સમાં વાતાવરણ ઊભું કરવું પડે!!

સંતાન:

જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને આ વરસના અંતમાં ઈચ્છા પૂરી થાય. જેમના સંતાનો મોટા છે તેમને પણ આ વરસમાં ખાસ કોઈ ટેન્શન થાય એવું નથી. એમનો અભ્યાસ નોકરી ધંધો બધું સંતોષકારક ચાલ્યા કરશે બસ, તમારા

સંતાનને જો શનિની પનોતી ચાલતી હોય તો તેને માટે ચોક્કસ ટેન્શન થઈ શકે!

અભ્યાસ:

વિદ્યાર્થી મિત્રો, અભ્યાસને માટે આ વરસમાં આપના ગ્રહમાન મધ્યમ છે. તમારી મહેનત કરતા થોડું ઓછું પરિણામ મળે એવું બને. વરસ દરમ્યાન અભ્યાસમાં કેટલીક અડચણો કેટલાક વિઘ્નો આવે. પરીક્ષાના સમયે જ કોઈ ટેન્શન થઈ શકે. આ બધી બાબતોનો ખ્યાલ રાખી ને વધારે મહેનત કરવાની જરૂર છે. આગળના અભ્યાસ માટે પણ તમારી ઈચ્છા પ્રમાણે કે તમારા પ્લાનીંગ પ્રમાણે કામ થવામાં વિલંબ થાય કે પછી તમારે તમારો નિર્ણય બદલવો પડે એવું બને.

પ્રવાસ:

પ્રવાસ મુસાફરીને માટે આ વરસમાં આપના ગ્રહમાન સારા છે. વરસ દરમ્યાન કુલ ત્રણ પ્રવાસ થાય. એક પ્રવાસ આનંદ પ્રમોદને માટે થાય. બીજો પ્રવાસ સગા સંબંધી કે મિત્ર મંડળ સાથે થાય અને ત્રીજો પ્રવાસ સામાજિક કામને માટે થાય. આ ઉપરાંત એક પ્રવાસ આકસ્મિક થાય કે જેનું કોઈ અગાઉથી પ્લાનીંગ નહીં હોય.

મિત્ર-શત્રુ:

મિત્રોની બાબતમાં આપના ગ્રહમાન ઘણાં સારા છે. વરસ દરમ્યાન નવી ઓળખાણ થાય અને મિત્રોની સંખ્યા વધે. મિત્રો આપને મદદરૂપ થાય. આર્થિક કે સામાજિક કામ માટે આપને જરૂર પડે તો મિત્રોની મદદ મળી રહેશે. શત્રુ જેવું ખાસ છે નહીં. પરંતુ ભૂતકાળમાં તમારી કોઈ ભૂલને લીધે સંબંધમાં અંતર પડી ગયું હોય તો તે પાછું તમારે રીપેરીંગ કરી લેવું.

કોર્ટ-કચેરી:

કોર્ટ કચેરી કે કોઈપણ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ સિવિલિયન ટેન્શન થાય એવું નથી તેમ છતાં તમારા કોઈ કેસ પેન્ડીંગ હોય તો તેમાં તમારે સમાધાન કરીને કેસ પૂરા કરી દેવાનું સલાહ ભરેલું છે. કોઈ પાર્ટી સાથે હિસાબ કિતાબ બાકી હોય કે આપવા લેવાનું બાકી હોય તો તે કામ સમાધાનથી કે બાંધણી કરીને પતાવી દેવું કારણ કે આવનારો સમય આ બધાં કામને માટે સારો નથી.

તંદુરસ્તી:

તંદુરસ્તીમાં આ વરસમાં બે વખત ગરબડ થાય. સાધારણ માંદગી આવે. અઠવાડિયું આરામ કરવો પડે. ગ્રીસ વરસથી મોટી ઉંમરની વ્યક્તિઓ માટે કોલેસ્ટ્રોલની તકલીફ રહેશે અથવા વજન વધે. પિસ્તાલીસ વરસથી મોટી ઉંમરની વ્યક્તિઓને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ થવાની શક્યતા છે. અડસઠ વરસથી મોટી વ્યક્તિઓને હાડકાના દુખાવાની તકલીફ થઈ શકે. તમારા નજીકના સગા સંબંધીમાં કોઈ વડીલનો વિયોગ થઈ શકે.